

UkLSpLk÷ «kuøkúk{Lke Mkw[Lkkyku

xUkLSpLk÷ «kuøkúk{Lke Mkw[Lkkyku
yÚkðk RyuMkyu÷(çkeS ¼k»kk ikhefu
ytøkúuS)yu ÷kþf rðäkÚkeoykuLku ykuAe -
rðMík]ik ykÄkh Mkk{økúe Äkwhe Äkkzðk
{kxu sYhe Au. «kuøk{kko rðäkÚkeoykuLku
þkþkLkk rð»kþku y™u ytøkúS þe¾ðk{kt
MkVª Úkðk {ËË fhu Au. «kuøkúk{ þu÷xzo
\$ðk÷ep RLMkxÙþfLkLkku WÄkþkuðk
fheLku ytøkúuS ¼k»kk{kt Mkw[Lkkyku
ykÄku Au. «kuøkú{kt «Míkwi¼k»kkLkkt
fux÷kf WËknhýku Au: {tËrhLk, rðþuxLkk{el,
÷kyku, yLku yuhurçkf

બેવડી ભાષા

«kuøkúk{Lkku nuikw çktLku ¼k»kk, çktLku
r÷rÄk yLku çktLku MktMfwrikLkkt MktË¼o{kt
Äknu÷k rðäkÚkeoyku{kt {sçkwík fþkyku yLku
«ðeyíkk yLku ÄkAe ¼k»kk rðfMkkðkLkku
Au. U-46 yuf {køkeo yLku ýe{køkeo ¼k»kk
(zeyu÷) «kuøkúk{ {kuzu÷ ykÄku Au. yuf
{køkeo yLku çku {køkeo «kuøkúk{ Mk{kLk
ÄkkþkLkk rMkØktík Ähkðu Au Äkhtík
¼k»kkykuLke çkLkkðx{kt VuhVkh Au.

U-46 {kt yuf {køkeo zâwy÷ ¼k»kk
«kuøkúk{ku Vðík yuf ¼k»kk swÚLkwt
çkLku÷w Au: MÄkurLkp çkku÷ikk
rðäkÚkeoyku su ELL MkŠðMk {uððk {kxu
÷kþf Au.

U-46 {kt ïe {køkeo zâwy÷ ¼k»kk «kuøkúk{ku
çku ¼k»kk swÚLkwt çkLku÷w Au: U-46 {kt
yuf {køkeo zâwy÷ ¼k»kk «kuøkúk{ku Vðík

yuf ¼k»kk swÚLkwt çkLku÷w Au: MÄkurLkp
çkku÷ikk rðäkÚkeoyku su ELL MkŠðMk {uððk
{kxu ÷kþf Au

- MÄkurLkp çkku÷ikk rðäkÚkeoyku su ELL
MkŠðMk {uððk {kxu ÷kþf Au y™u su Mkuðkyku
Mðefkhu Au y™u
- MÚkkrLkf ytøkúuS y™u / ytøkúuS «¼wið
Ähkðikk rðäkÚkeoyku
- * ELL «kuøkúk{Lkkt ððkkuo MLkk÷kf
ykð~þkfíkkykuLke Äkh ykÄkheík Au

\$ðk÷ep ÷UðkðuÍ ÷Lkoh «kuøkúk{ rðþu {knike
ðþktÚke {þþu?

ðÄw {kneike {kxu , {nuhçkkLke fheLku MktÄkfo
fhku U-46 Dual Language Program Brochure
ELL ðuçkMkkRx Äkh WÄk÷çÄ Au:

www.u-46.org/ell

Family Welcome Center

355 East Chicago Street

Suite #231

Elgin, IL 60120

(847) 888-5000 ext. 6038

U-46 En Español

<http://www.u-46.org/spanish/>

**School District U-46 ELL Parent Handbook
is available in ENGLISH, SPANISH, POLISH,
TAGALOG and GUJARATI**

સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46

અંગ્રેજી ભાષા

શીખવાના કાર્યક્રમો



**English Language Learners
Educational Services Office
355 East Chicago Street
Elgin, IL 60120
847-888-5000 Ext. 5331**

Gujarati SY 2012-2013



જો માતું બાળક અંગ્રેજી સારી રીતે ના બોલતું હોય, તો કઈ સેવાઓ ઉપલબ્ધ છે?

ઈએલએલ વિદ્યાર્થીઓ માટે સેવાઓ

ફેમિલી વેલકમ સેન્ટર:

- nku{ ÷Uøkøus M kōuo {khVík Èhuf rōākÚkeoLke ytøkúuS ¼k»kk «¼wíð þkuÄðk {kxu rçkLk ytøkúuS ykÄkh Mkk{økúe Ähkøu Au «&™Lkkt sðkçk{kt “nk” Lke «rikrçþkLku ykÄkhu yku¾¾¾.


- Ryu÷yu÷ Mkuðkyku {uðððk {kxu rōākÚkeoLke ÷kþfík Lk~e fhðk {kxu Mkw[ðkþu÷ Mkk{økúe çkçkíkku Äkh ykÄkh hk¾¾u Au. òu rōākÚkoe Ryu÷yu÷ Mkuðkyku {uðððk {kxu ÷kþf Au, Vur{÷e òu÷f{ MkuLxh þkuøþ MÚkþLke ¼÷k{ý fhþu.

- Lkðk ÄkrhðkhkuLku íku{Lkk çkçkþfku {kxu WÄk÷çÄ yLkwËupe «kuøkúk{Lkkt ùku°kku sýkððk.

- LkkUÄýe «rçþk røþu òýfkhe Äkwhe Äkkzðe

- Lkðk ÄkrhðkhLku þkþk rzMxÙeðx þw-46 y™u «Ëup{kt WÄk÷çÄ MkkÄLkMkk{økúeLkkt MÚkþ røþu sýkððwt.

Lkðk ÄkrhðkhLku þkþk rzMxÙeðx þw-46 y™u «Ëup{kt WÄk÷çÄ



nw fuðeheíku òýe þfw fu {kÁ çkçkþf Ryu÷yu÷ Mkuðk {kxu ÷kþf Au?

નોંધણીના સમયે, કુટુંબો વિદ્યાર્થી માહિતી ફોર્મ અને ઘરની ભાષાની મોજણી પૂરી ભરે છે. જો માતા-પિતાઓ કે કાયદેસર વાલીઓએ ઘરમાં બોલાતી ભાષાની મોજણીના બેમાંથી એક પ્રશ્નનો જવાબ “હા” આપ્યો હોય, તો પછી વિદ્યાર્થીઓની દેખરેખ સ્કીનર ઇન્સ્ટ્રુમેન્ટથી રાખવામાં આવશે. સ્કીનર ઇન્સ્ટ્રુમેન્ટનો હેતુ વિદ્યાર્થીની અંગ્રેજી ભાષાની કાબેલિયત નક્કી કરવાનો અને વિદ્યાર્થીની ઈએલએલ સેવાઓ મેળવવાની યોગ્યતા ઓળખવાનો છે.

સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46 વિદ્યાર્થીની યોગ્યતા નક્કી કરવા માટેના આધાર તરીકે ઈલિનોઇસ રાજ્યના શિક્ષણ વિભાગે સૂચવેલા સ્કીનર ઇન્સ્ટ્રુમેન્ટો **Pre-IPT**, **WIDA MODEL™** અને **ACCESS W-APT™** નો ઉપયોગ કરે છે.

જે વિદ્યાર્થીઓ ઈલિનોઇસની શાળાઓમાં અંગ્રેજી ભાષાની કુશળતા અંગે આઇએસબીઇની નક્કી કરવામાં આવેલી વ્યાખ્યાથી ઓછા ગુણ ધરાવતા હોય તેઓ ઈએલએલ સેવાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે.

આ સ્કીનર ઇન્સ્ટ્રુમેન્ટના પરિણામો પર આધાર રાખીને યોગ્ય નિયુક્તિ અને સેવાઓના સંદર્ભમાં ભલામણ કરવામાં આવે છે.

ભલામણ અને સેવાઓ, તેમજ કાર્યક્રમની વિગતો સમજાવતો માતા-પિતાને જાણ કરતો પત્ર પૂરો પાડવામાં આવે છે. માતા-પિતાઓ ઈએલએલ નિયુક્તિની ભલામણો સ્વીકારી કે નકારી શકે છે.

જો સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46 દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રવેશ ધોરણો અનુસાર વિદ્યાર્થી ઈએલએલ સેવાઓ માટે પાત્ર ન બને, તો માતા-પિતાઓને આ નિર્ણય સામે અહીં અપીલ કરવાનો હક્ક છે:

Kane County Regional Office of Education
210 South 6th Street,
Geneva, Illinois 60134
Phone number (630) 232-5955



સંક્રાન્તિને લગતો દ્વિભાષી શિક્ષણ (ટીબીઇ) કાર્યક્રમ ઉચ્ચ ઉપયોગાધિન ભાષાના ઈએલએલ વિદ્યાર્થીઓ માટે છે. કાર્યક્રમ અંગ્રેજીમાં સંક્રાન્તિ સાથે વિદ્યાર્થીની માતૃભાષામાં સૂચના પૂરી પાડે છે.